

કૃષિ મહાવિદ્યાલય-વ-કૃષિ પોલિટેકનિક, વસો ખાતે યોજાયેલ સાતમો વાર્ષિક દિન ઉજવણી કાર્યક્રમ
“ વસોધરા-૨૦૧૯ ”

તારીખ ૧૨/૦૪/૨૦૧૯ ના રોજ કૃષિ મહાવિદ્યાલય-વ-કૃષિ પોલિટેકનિક , આણંદ કૃષિ યુનિવર્સિટી , વસો ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. એન.સી.પટેલના પ્રમુખપદે સાતમો વાર્ષિક દિન “વસોધરા-૨૦૧૯” ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ ગયેલ. આ વાર્ષિક દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા અને લોકપ્રિય એવા ગુજરાતી લેખક,કોલમીસ્ટ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી (બં.અ.કૃષિ મહાવિદ્યાલય) શ્રી દીપક સોલીયા તથા અતિથિ વિશેષ તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો. કે. બી. કથીરીયા તથા યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામકશ્રી ડો. એમ. એમ. ત્રિવેદી તથા ડીનશ્રી (કૃષિ) ડો. એમ.વી.પટેલ તથા ભૂતપૂર્વ કુલપતિશ્રી ડો.એ.એમ.શેખે હાજર રહી પ્રસંગને દિપાવ્યો હતો.

આ વાર્ષિક દિન ઉજવણીના કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે એક મિનિટ,અંતાક્ષરી, ડમશેરાડ , ખાટ પે બાત , ટગ ઓફ વોર , સીનેમેજીક, સિંગીંગ, ડાન્સીંગ, વગેરેનું આયોજન થયેલ જેમા બંને કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધેલ. ઉપરાંત વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ રંગોળી , ગરબા, સુશોભનના કાર્યક્રમમાં પણ ખુબ જ રસપુર્વક ભાગ લીધેલ.

કાર્યક્રમની શરૂઆતમાં બંને કોલેજના આચાર્યશ્રી ડો. વાય. એમ. શુક્લએ આમંત્રિત મહાનુભાવોનો તથા સર્વે ઉપસ્થિત પ્રાધ્યાપકગણ તથા વિદ્યાર્થી મિત્રોનો શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ તેમજ વર્ષ દરમિયાન કોલેજના થયેલ વિકાસની ચર્ચા કરેલ. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન વિવિધ રમત ગમત તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ વિજેતા બનનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મહાનુભાવો દ્વારા ઇનામ વિતરણ કરવામા આવેલ તથા મહાનુભાવોએ પોતાના વ્યક્ત્ય દ્વારા ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર બેચને ઉત્તમ કારકીર્દી માટે માર્ગદર્શન, આર્શીવચન તથા અભિનંદન પાઠવેલ.

કાર્યક્રમના અંતમાં એસ.આર.સી. ચેરમેન ડો. સહદેવ લુહારે કાર્યક્રમની સફળતા માટે લીધેલ ભારે જેહમત બદલ સૌનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કરેલ અને રાષ્ટ્રગાન સાથે સાતમો વાર્ષિક દિન “વસોધરા-૨૦૧૯” ના ઉજવણી કાર્યક્રમની પૂર્ણાહુતિ થયેલ.

“વસોધરા-૨૦૧૯” ની કેટલીક યાદગાર પળો



...2...




